

COVID-19 રસી

રસી એટલે શું?

રસી એક પ્રકારની દવા છે. તે નીડલ અથવા શાઉટમાં મળે છે.

રસી શું કામ કરે છે?

રસી મૂકાવવાથી તે તમને બીમાર પડતા રોકે છે. અહીંજુદી જુદી માંદગીઓ અને રોગો માટે જુદા જુદા પ્રકારની રસીઓ હોય છે.

શું રસીઓ સલામત છે?

હા. રસીઓ સલામત છે તે સુનશ્ચિતિ કરવા માટે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સખત મહેનત કરે છે. ફક્ત એવી જ રસીઓ જે સલામત છે તે જ કંનેડામાં ઉપયોગ કરવા માટે માન્ય થયેલ છે. રસીઓની સલામતીની અવારનવાર સમીક્ષા કરવામાં આવે છે.

શું COVID-19 માટેની કોઈ રસી છે?

હા, COVID-19 માટે નવી રસીઓ છે.

શું COVID-19 ની રસીઓ સલામત છે? તેઓને ખૂબ જ ઝડપથી બનાવવામાં આવી હતી.

હા. COVID-19 ની રસીઓ સલામત છે તે સુનશ્ચિતિ કરવા માટે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ સખત મહેનત કરી છે. ફક્ત એવી જ રસીઓ જે સલામત છે તે જ કંનેડામાં ઉપયોગ કરવા માટે માન્ય થયેલ છે. રસીઓની સલામતીની અવારનવાર સમીક્ષા કરવામાં આવે છે.

શું મને રસીથી COVID-19 નું સંક્રમણ થઈ શકે છે?

ના. તમને રસીથી COVID-19 નું સંક્રમણ થઈ શકે નહીં. રસી તમારા શરીરને COVID-19 ની ઓળખ કરવામાં અને તેની સામે લડવામાં મદદ કરે છે.

શું COVID-19 ની રસીની કોઈ આડ અસરો છે?

તમે રસી મેળવો ત્યારબાદ તમને આડ અસરો થઈ શકે છે. જ્યાં તમને શાઉટ મળેલ છે ત્યાં તમારા હાથમાં પીડા થઈ શકે છે. તમને થાક લાગી શકે અથવા તાવ આવી શકે. આનો અર્થ એમ કે તમારું શરીર રસીને પ્રતિભાવ આપી રહ્યું છે. આ આડ-અસરો થોડાક દવિસો સુધી રહી શકે છે.

કેટલાક લોકો રસીઓથી એલર્જિકિ હોઈ શકે છે. તેઓને કદાચ વધુ ગંભીર આડ અસરો થઈ શકે છે. આ ગંભીર આડ અસરો જવલ્લે જ થાય છે.

જો મારા લક્ષણો થોડા દવિસો કરતા વધુ સમય સુધી રહે તો શું?

તમે રસી મૂકાવો તે પહેલાં જ તમને વાઈરસનું સંક્રમણ લાગેલ હોઈ શકે છે. જો તમારા લક્ષણો એક કે બે દવિસથી વધારે રહે તો, તમે પડી શકો છો. તમારે સેલફ-આઈસોલેટ થઈ જવું જોઈએ અને COVID-19 નું પરીક્ષણ કરાવી લેવું જોઈએ.

રસી પ્રથમ કોણ મેળવશે?

મેન્ટોબામાં રસી પ્રથમ ડૉક્ટરો, નર્સો અને અન્ય આરોગ્ય-સંભાળ પ્રદાતાઓ મેળવી રહ્યા છે.

અન્ય લોકોમાંથી કેટલાક એવા લોકો પ્રથમ રસી મેળવી રહ્યા છે જેઓ ખૂબ જ માંદા પડી શકે છે. આમાં વૃદ્ધ લોકો અને મૂળનવિાસી લોકોનો સમાવેશ થાય છે.

મને રસી ક્યારે મળી શકે છે?

દરેક જણ માટે પર્યાપ્ત પ્રમાણમાં રસી બનાવવામાં સમય લાગે છે. જુદા જુદા લોકોને જુદા જુદા સમયે રસી મળશે. સરકાર અને નિષ્ણાતો આ નિર્ણયો લેવા માટે સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. જ્યારે લોકોને રસી લેવાનો સમય થશે ત્યારે વધુ માહિતી શેર કરવામાં આવશે.

જો મને રસી મળી જાય તો પણ શું મારે માસ્ક પહેરી રાખવું પડશે અને અન્ય લોકોથી દૂર રહેવું પડશે?

હા. માસ્ક પહેરી રાખવાથી અને શારીરિક અંતર જાળવવાથી તમને અને અન્ય લોકોને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

શું મારે રસી મેળવવા માટે પૈસાની ચૂકવણી કરવી પડશે?

મેન્ટોબામાં લોકો માટે આ રસી નિ:શુલ્ક છે.

શું મારે રસી લેવી પડશે?

તમારે પસંદ કરવું પડશે કે તમે COVID-19 ની રસી લેવા માંગો છો કે કેમ. તમારે રસી લેવી જ પડે એવું જરૂરી નથી.

ઘણાં બધા લોકો રસી વર્ષે જુદી જુદી વાતો કહી રહ્યા છે. કેટલીક માહિતી સાચી ન પણ હોઈ શકે. તમે રસી વર્ષે વધુ જાણવા માટે આરોગ્ય-સંભાળ પ્રદાતાઓ સાથે વાત કરી શકો છો. તેઓ તમને સારી માહિતી પૂરી પાડશે.

હાઉસ ઓફ કોન્સિડેરેશન ઓફ ડિવેલપમેન્ટ

manitoba.ca/COVID19/vaccine ક્લિક કરો ૧૮૦૮૮૮

Manitoba 